



18th July, 2024

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001

National Stock Exchange of India Limited

Exchange Plaza, Plot No. C/1, G Block,
Bandra-Kurla Complex,
Bandra (East), Mumbai - 400 051

Scrip Code: **521070**

Symbol: **ALOKINDS**

Dear Sir/Madam,

Sub: Newspaper Publication – Unaudited Consolidated Financial Results for the quarter ended 30th June, 2024.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of the newspaper publication for the Unaudited Consolidated Financial Results for the quarter ended 30th June, 2024, published in Business Standard (English) and Lokmitra (Gujarati) newspapers on 18th July, 2024.

Kindly take record of the same.

Thanking you,

Yours faithfully,

For Alok Industries Limited

Hitesh Kanani

Company Secretary & Compliance Officer

Membership No. F6188

Encl.: As Above

Continue From Previous Page...

BOOK RUNNING LEAD MANAGER	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY & COMPLIANCE OFFICER
<p>UNISTONE CAPITAL PRIVATE LIMITED A/305, Dynasty Business Park Andheri-Kurla Road, Andheri East, Mumbai - 400 059. Telephone: 022 4604 6494 Email: mb@unistonecapital.com Investor grievance email: compliance@unistonecapital.com Contact Person: Brijesh Parekh Website: www.unistonecapital.com SEBI registration number: INM000012449 CIN: U65999MH2019PTC330850</p>	<p>BIGSHARE SERVICES PRIVATE LIMITED S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai – 400093, Maharashtra, India Telephone: +91 22- 6263 8200 Email: ipo@bigshareonline.com Contact Person: Vinayak Morbale Website: www.bigshareonline.com SEBI Registration Number: INF000001385 CIN: U99999MH1994PTC0765346</p>	<p>Neha Jain Manglam Infra & Engineering Limited H.NO.46, Nikhil Nestles Jatkhedi Hoshangabad Road, University (Bhopal) Huzur, Bhopal - 462026, Madhya Pradesh, India Tel No.: +0755- 2569877/4289475 Website: www.manglaminfra.com Email id: cs@manglaminfra.com</p> <p>Investors can contact the Company Secretary and Compliance Officer, BRLM or the Registrar to the Issue in case of any pre-issue or post issue related problems, such as non-receipt of letters of Allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode.</p>

AVAILABILITY OF RHP: Investors should note that investment in Equity Shares involves a high degree of risk and investors are advised to refer to the Red Herring Prospectus and the Risk Factor contained therein, before applying in the Issue. Full copy of the Red Herring Prospectus shall be available at the website of Stock Exchange www.nseindia.com, the website of Book Running Lead Managers www.unistonecapital.com and from the Registered Office of the Company.

AVAILABILITY OF BID-CUM-APPLICATION FORMS: Bid-Cum-Application forms can be obtained from the Registered Office of the Company: **Manglam Infra & Engineering Limited** (Telephone: +0755 4289475) **BRLM: Unistone Capital Private Limited** (Telephone: 022-4604 6494) **Syndicate Member: Giriraj Stock Broking Private Limited** (Telephone: 033-40054519 / 9547473969), Registered Brokers, RTA and CDPs participating in the Issue. Bid-cum-application Forms will also be available on the websites of, NSE (www.nseindia.com) and the designated branches of SCSBs, the list of which is available at websites of the Stock Exchange and SEBI.

SYNDICATE MEMBER: Giriraj Stock Broking Private Limited

BANKERS TO THE ISSUE/ SPONSOR BANK / ESCROW COLLECTION BANK / PUBLIC ISSUE BANK / REFUND BANK: HDFC Bank Limited

UPI: UPI Bidders can also Bid through UPI Mechanism

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

For MANGLAM INFRA & ENGINEERING LIMITED

On Behalf of the Board of Directors

Sd/-

Ajay Verma

Managing Director

Place: Bhopal

Dated: July 17, 2024

MANGLAM INFRA & ENGINEERING LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the RHP with Registrar of Companies, Gwalior, Madhya Pradesh on July 17, 2024. The RHP shall be available on the website of the BRLM to the issue at www.unistonecapital.com and websites of NSE i.e. www.nseindia.com. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, see section titled "Risk Factors" beginning on page 31 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision.

The Equity Shares offered in the issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and any applicable U.S. state securities laws. There will be no public offering in the United States and the securities being offered in this announcement are not being offered or sold in the United States.

पंजाब नैशनल बैंक Punjab National Bank
Circle SASTRA, 6th Floor, Gujarat Bhavan,
Nr. M.J. Library, Ellisbridge, Ahmedabad - 380 006.

Appendix-IV [Under Rule 8(1)]
POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Punjab National Bank, under the Securitisation and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules-2002, issued Demand Notice dated 11.12.2023 calling upon the Borrowers / Guarantor / Mortgagor Mr. Arpan Jatibhai Setalwad (Borrower) and Mrs. Sweta Arpanbhai Setalwad (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 34,88,032.48 in respect Loan Account No. 100300N00003901 and Rs. 14,72,605.00 in respect Loan Account No. 1003009900000831 Total Rs. 49,60,637.48 (Rs. Forty Nine Lakhs Sixty Thousand Six Hundred Thirty Seven and Paise Forty Eight Only) as on 11.12.2023 payable with further interest and expenses until payment in full, within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 14.07.2024.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The Borrowers / Guarantors / Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Punjab National Bank, for an amount of Rs. 34,88,032.48 in respect Loan Account No. 100300N00003901 and Rs. 14,72,605.00 in respect Loan Account No. 1003009900000831 Total Rs. 49,60,637.48 (Rs. Forty Nine Lakhs Sixty Thousand Six Hundred Thirty Seven and Paise Forty Eight Only) as on 11.12.2023 and payable together with further interest and costs thereon until payments/realization in full.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of Immovable property of Mrs. Shwetaben Arpanbhai Setalwad consisting of Property situated at Block No. A, Flat No. 601, Admeasuring about Carpet area 62.51 Sq. Mtrs. (Built up area 65.93 Sq. Mtrs.) alongwith proportionate undivided share in the land of scheme together with construction standing thereon in the Scheme Known as "Rajyash Reva", Lying, being and situated on the land of Survey No. 523/2, T.P. Scheme No. 94, F.P. No. 19, Sub Plot No. 2 situated at Mouje - Shahvadi, Taluka - Vatva in the Registration Sub - District of Ahmedabad - 5 (Narol) within the State of Gujarat. **Bounded by:** East: Flat No. A-602, West: Society Common Road, North: 60 Ft. T.P. Road, South: Staircase, Lift and Common Passage.

Date: 14.07.2024 | Place: Ahmedabad | Sd/- Authorized Officer, Punjab National Bank

PUBLIC NOTICE REGARDING TITLE CLEARANCE REPORT

This is to inform the general public that property bearing Plot No.1, admeasuring 134.16 sq.mtrs., alongwith Ground Floor+ First Floor and Second Floor construction admeasuring 210.9 sq.mtr., togetherwith undivided share in underneath land in "Swastik Park", Situated on the land bearing Revenue Survey No/ Block No.60/3/A, T.P. Scheme No.35 (Katargam), F.P. No.71 at Village: Katargam, Taluka: Katargam, Dist. Surat. is under the ownership & possession of Laljibhai Harjibhai Mangukiya. The Owner has stated that below mentioned Page No. 27 (As per Sub Registrar Seal) of the Registered Sale Deed Sr. No. 9653, dt. 03.05.2016 has been lost/misplaced somewhere. The Owner wants to take a Loan on this property from the Bank therefore He asked for Title Clearance Certificate in respect of said property. Therefore, by this notice this is to inform that if anyone has right, interest, share, relation, attachment or any claim in this property, then shall inform in writing to the undersigned at below mentioned address within 7 days from receipt of this notice. Failing which it believes that nobody has any right or interest in said property and if any, then has waived & released. After notice period and our client bank's first charge will be count on this property & Title Clearance Certificate will be issued and latter on no dispute of anybody will be entertained, which please note. Then the title clearance report will be given about the said Property.

DETAILS OF LOST/MISPLACED ORIGINAL DOCUMENTS:
Page No.27 (As per Sub Registrar Seal) of Original Sale Deed registered in the office of Sub-Registrar, Surat at Sr.No.9653, dt.03.05.2016.

RINKY A. VARMA
Advocate
Office at: 414-415, Rajhans Ormate,
Nr. Jani Farsan, Parle Point, Surat.
985007 Mo.7043246647

NIDO HOME FINANCE LIMITED
(formerly known as Edelweiss Housing Finance Limited) Registered Office Situated At
Tower 3, 5th Floor, Wing 'B', Kohinoor City Mall, Kohinoor City, Kiroi Road, Kurla (West),
Mumbai - 400 070. Regional Office at: Office No. 301,302,303,304, 3rd Floor, 3rd Eye Vision Building, IIM -
Panjrapole Road, Ahmedabad - 380015

POSSESSION NOTICE UNDER RULE 8(1) OF THE SARFAESI ACT, 2002

Whereas the Undersigned being the Authorized Officer of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (order 3 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued Demand Notices to the Borrower/s as detailed hereunder, calling upon the respective Borrowers to repay the amount mentioned in the said notices with all costs, charges and expenses till actual date of payment within 60 days from the receipt of the same. The said Borrowers/Co borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Co borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described hereunder in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules, in the dates mentioned alongwith the Borrowers in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited). For the amount specified therein with future interest, costs and charges from the respective dates.

Details of the Borrowers, Co-borrowers and Guarantors, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed thereunder and Date of Possession is given as under:

1. Name and Address of the Borrower, Co Borrower, Guarantor Loan Account No. And Loan Amount:-
SANJAYBHAI GORDHANBHAI GOHEL (Borrower) BHARATBHAI GORDHANBHAI GOHEL (Guarantor) Resi Address: Flat No. 404, Fourth Floor, Wing A, Akshar City, B/H Jain Derasar, Off. Bhavnagar Road Rajkot 360003
LAN.No.: LRJKSTH000091676 Loan agreement Date: 30.11.2021 Demand Notice Date: 12-04-2024
Loan Amount : Rs. 16,85,548/- (Rupees Sixteen Lakh Eighty Five Thousand Five Hundred Forty Eight Only)
Amount Due in Rs. 14,75,854.43/- (Rupees Fourteen Lakhs Seventy Five Thousand Eight Hundred and Fifty Four and Forty Three paise Only) Possession Date: 16.07.2024

Details Of The Secured Asset:- All That Right, Title And Interest Of Constructed Residential Property Of Flat No. A-404 Measuring 60.70 Sq. Mts. At Revenue Survey No. 196/2P2 P City Survey Ward No. 122 Citysurvey No. 4439/5/2 Single Unit & Common Plot P Akshar City At Rajkot The Said Flat Is Bounded As: North: Flat No. A/403, South: Open Space, East: Open Parking & Road, West: Common Passage & Stair.

Place: Rajkot
Date: 18.07.2024
Sd/- Authorized Officer
FOR Nido Home Finance Limited,
(formerly known as Edelweiss Housing Finance Limited)

SMFG INDIA CREDIT COMPANY LIMITED
(formerly Fullerton India Credit Company Limited)

Corporate Office: 10th Floor, Office No. 101, 102 & 103, 2 North Avenue, Maker Maxity, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051.

DEMAND NOTICE

UNDER THE PROVISIONS OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ("the Act") AND THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 ("the Rules")

The undersigned being the authorized officer of SMFG INDIA CREDIT COMPANY LIMITED (formerly Fullerton India Credit Company Limited) (SMFG India Credit) under the Act and in exercise of powers conferred under Section 13(12) of the Act read with the Rule 3, issued Demand Notice(s) under Section 13(2) of the Act, calling upon the following borrower(s) to repay the amount mentioned in the respective notice(s) within 60 days from the date of receipt of the said notice. The undersigned reasonably believes that borrower(s) is/are avoiding the service of the demand notice(s), therefore the service of notice is being effected by affixation and publication as per Rules. The contents of demand notice(s) are extracted herein below:

Sr. No.	Name of the Borrower(s)/Legal Heir(s).	Demand Notice Date Amount
1.	SHREE SECURITY AND DETECTIVE SERVICES.	09th July, 2024 Rs. 1,07,98,189/-
2.	AMANDEEPAUR GILL.	(Rupees One Crore Seven Lakhs Ninety Eight Thousand One Hundred and Eighty Nine Only) As on 08th July, 2024
3.	UNKNOWN LEGAL HEIRS (KULVINDAR GILL (DECEASED) LEGAL HEIRS).	

Description of Immovable Property Mortgaged: Owner of The Property - Kulvindersingh Mahendrasingh Gill. All That Property Piece And Parcel of Duplex on Plot No. 216/1 Admeasuring about 90 Sq. Mtrs. Plot Area & Construction Ground Floor And First Floor 67.22 Sq. Mtrs. Gandhinagar Township Situated At Sector No. 14 Mouje Gandhinagar Taluka Gandhinagar Dist. & Sub District Gandhinagar. Bounded By Boundaries As Under: East - 10 Mtrs Road, West - Plot No. 216/2, North - 6 Mtrs. Road, South - Plot No. 219/2.

The borrower(s) are hereby advised to comply with the demand notice(s) and to pay the demand amount mentioned therein and hereinafter within 60 days from the date of this publication together with applicable interest, additional interest, bounce charges, cost and expenses till the date of realization of payment. The borrower(s) may note that SMFG India Credits a secured creditor and the loan facility availed by the Borrower(s) is a secured debt against the immovable property/properties being the secured asset(s) mortgaged by the borrower(s). In the event borrower(s) are failed to discharge their liabilities in full within the stipulated time, SMFG India Credits shall be entitled to exercise all the rights under Section 13(4) of the Act to take possession of the secured asset(s) including but not limited to transfer the same by way of sale or by invoking any other remedy available under the Act and the Rules thereunder and realize payment. SMFG India Credit also empowered to ATTACH AND/OR SEAL the secured asset(s) before enforcing the right to sale or transfer. Subsequent to the Sale of the secured asset(s), SMFG India Credit shall have a right to initiate separate legal proceedings to recover the balance dues, in case the value of the mortgaged properties is insufficient to cover the dues payable to the SMFG India Credit. This remedy is in addition and independent of all the other remedies available to SMFG India Credit under any other law.

The attention of the borrower(s) is invited to Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets and further to Section 13(13) of the Act, whereby the borrower(s) are restrained/prohibited from disposing of or dealing with the secured asset(s) or transferring by way of sale, lease or otherwise (other than in the ordinary course of business) any of the secured asset(s), without prior written consent of SMFG India Credit and non-compliance with the above is an offence punishable under Section 23 of the said Act. The copy of the demand notice is available with the undersigned and the borrower(s) may, if they so desire, can collect the same from the undersigned on any working day during normal office hours.

SD/-
Authorized Officer
SMFG India Credit Company Limited
(formerly Fullerton India Credit Company Limited)

Place: Gujarat
Date: 18/07/2024.

ALOK INDUSTRIES LIMITED
CIN: L17110DN1986PLC000334
Regd Office: 17/5/1, 52/1/1 Village Rakholi / Sayli, Silvassa - 396230
Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu.
Tel No.: 0260-6637001; Email Id.: investor.relations@alokind.com; Website: www.alokind.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter Ended June 30, 2024

Sr. No.	Particulars	₹ in Crore, except per share data	
		Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023
1	Revenue from Operations	1,006.30	1,414.91
2	Net Profit / (Loss) for the period before Tax*	(206.87)	(226.14)
3	Net Profit / (Loss) for the period after tax	(206.87)	(226.14)
4	Total Comprehensive Income for the period	(208.62)	(224.13)
5	Paid up Equity Share Capital, Equity Shares of ₹. 1/- each	496.53	496.53
6	Other Equity excluding revaluation reserve	(20,481.00)	(19,621.09)
7	Earnings per equity share (EPS) (Face value of ₹.1/- each) (Not annualised):		
	Basic (in ₹.)	(0.42)	(0.46)
	Diluted (in ₹.)	(0.42)	(0.46)

* Includes Non-Controlling Interest

Notes:

1) The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results and its release at the respective meetings held on July 16, 2024. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.

2) Additional information on Unaudited Standalone Financial Results is as follows: (₹ in Crore)

Sr. No.	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023
i	Revenue from Operations	968.67	1,365.49
ii	Net Profit / (Loss) for the period before Tax	(197.51)	(220.80)
iii	Net Profit / (Loss) for the period after tax	(197.51)	(220.80)
iv	Total Comprehensive Income for the period	(197.62)	(220.15)

3) The above is an extract of the detailed format of the Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended on June 30, 2024 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended on June 30, 2024 are available on the Stock Exchanges' websites (www.bseindia.com / www.nseindia.com) and the Company's website www.alokind.com.

For Alok Industries Limited
SD/-
A. Siddharth
Chairman

Place : Navi Mumbai
Date : July 16, 2024

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFIT IT Park, Wagale Industrial Estate, Thane, Maharashtra- 400604

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.

Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs)	Name of Branch
1.	M/s. Ruby Electrical Corporation/ Ronak Sureshchandra Shah/ *001905009431, 003505017989 & 60390021993	Showroom No. 05, on Ground Floor & First Floor, In the Scheme Known as Hypeshot, Situated at Land Bearing Revenue Survey No. 152, Makarpura, Taluka & District Vadodara, Registration Sub-District & District Vadodara, Gujarat / July 13, 2024	January 31, 2024 Rs. 3,71,88,683/-	Vadodara

The above-mentioned borrower(s)/guarantor(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: July 18, 2024
Place: Vadodara

Sincerely Authorised Signatory
For ICICI Bank Ltd.

HDFC BANK **HDFC Bank Ltd.** **POSSESSION NOTICE**

HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone : (079) 66307000

Whereas the Authorised Officer/s of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13(2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MR. RAJESH D. MOURIYA (Borrower) MRS. CHANDRAPRABHA MORIYA (Co-Borrower)	Rs. 19,18,280/- And Rs. 12,88,932/- Respectively as on 31-Mar., 2024*	19-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	TENEMENT-B/5, BANSIDHAR VIBHAG-2, S. NO. 487/1 + 487/2, VRAJESHWARI C. H. S. L., NR. I. P. ENGLISH SCHOOL, VALLABH PARK, SABARMATI, AHMEDABAD-380019.
2	MR. ABDULGAFUR YASINBHAI SHAIKH (Borrower)	Rs. 14,21,541/- And Rs. 1,25,690/- Respectively as on 31-Mar., 2024*	19-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	FLAT-302, 3RD FLOOR, M. Y. SQUARE, S. NO. 239, NEXT TO OLD DENA BANK, NR. MUNICIPAL SCHOOL, DANILIMADA, AHMEDABAD-380028.
3	MR. GYANSINGH J. SANDHU (Borrower)	Rs. 5,71,227/- as on 31-Mar., 2024*	22-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	FLAT NO.-A/308, 3RD FLOOR, UMANG NAROL-II (BLOCK-A), R. S. 153/1, TP-60, FP-69, SP-1, NAROL OLD HIGH COURT, NR. LAXMI NAGAR, NAROL, AHMEDABAD-382405.
4	MR. BALBIR SINGH (Borrower) MRS. KRISHNA DEVI (Co-Borrower)	Rs. 8,12,221/- And Rs. 75,026/- Respectively as on 31-Mar., 2024*	22-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	UNIT-507, 5TH FLOOR, BIJAL BUSINESS CENTRE, BLOCK-C, PLOT FP-5, S. NO. 123, CS NO.-867, TP-74, OPP. SHYAM ICON, NR. RADHE COMPLEX, ASLALI CIRCLE, AHMEDABAD-382427.
5	MR. BALBIR SINGH (Borrower) MRS. KRISHNA DEVI (Co-Borrower)	Rs. 92,615/- And Rs. 18,38,217/- Respectively as on 31-Mar., 2024*	22-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	UNIT-F-7, NILKANTH KUTIR, PLOT-728, S. NO. 728, 729, 730, 731, 732, 733, (BLOCK-822, 843 TO 847), 200 FT. VATVA TO GAMDJI GAM ROAD, TA.-DASKROI, AHMEDABAD-380008.
6	MR. CHANDRAKANT RUGNATH PANCHAL (Borrower) MRS. SADHANA CHANDRAKANT PANCHAL (Co-Borrower)	Rs. 30,447/- And Rs. 23,93,434/- Respectively as on 31-Mar., 2024*	19-Apr., 2024	15-July, 2024 Symbolic Possession	FLAT-B1/601, 6TH FLOOR, SHARANAM SKY BLOCK-(A1+B1), PLOT FP NO.-7/2, S. NO. 5, TPS NO.-113, B/H RELIANCE PETROL PUMP, B/S SANT VILLA, S. P. RING ROAD, VASTRAL, AHMEDABAD-382315.
7	MR. JAYESHKUMAR PARAMAR (Borrower) MRS. AMRUTABEN SUTARIYA (Co-Borrower)	Rs. 20,33,653/- And Rs. 1,80,673/- Respectively as on 31-Mar., 2024*	22-Apr., 2024	12-July, 2024 Symbolic Possession	UNIT-20, VRUNDAVAN BUNGLOWS, S. NO. 62P/1, PATAN-SANKHARI ROAD, NR. SHAKUNTAL GREEN CITY, PATAN-360530.
8	MR. AMRUTBHAI LILABHAI RABARI (Borrower)	Rs. 7,30,432/- as on 31-Mar., 2024*	22-Apr., 2024	12-July, 2024 Symbolic Possession	BUNGLOW-10, PARIJAT BUNGLOWS, S. NO. 420, SATYAM SHIVAM SUNDARAM ROAD, SIDDHPUR THREE ROADS, SIM : RUNI, PATAN-GUJARAT-360530.
9	MR. KALPESH B. TURI (Borrower)	Rs. 9,05,887/- And Rs. 21,20,811/- And Rs. 10,76,450/- Respectively as on 31-Mar., 2024*	19-Apr., 2024	12-July, 2024 Symbolic Possession	BUNGLOW-58, ROYAL PALACE-2, S. NO. 895, NR. ANSURI SOCIETY, OPP. VIVEK MOTORS, CHANASMA ROAD, PATAN H. O., PATAN-GUJARAT-384265.

*With further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation.

However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer/s of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited) by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) have taken possession of the immovable property (ies) / Secured Asset(s) described herein above in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid immovable property (ies) / Secured Asset(s) and any dealings with the said immovable property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.


Copies of the Panchnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is/are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 17-07-2024
Place : Ahmedabad

For, HDFC Bank Ltd.
SD/-
Authorized Officer

Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.
CIN : L65920MH1994PLC080618, Website : www.hdfcbank.com

Continue From Previous Page...

BOOK RUNNING LEAD MANAGER	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY & COMPLIANCE OFFICER
 <p>UNISTONE CAPITAL PRIVATE LIMITED A/305, Dynasty Business Park Andheri-Kurla Road, Andheri East, Mumbai - 400 059. Telephone: 022 4604 6494 Email: mb@unistonecapital.com Investor grievance email: compliance@unistonecapital.com Contact Person: Brijesh Parekh Website: www.unistonecapital.com SEBI registration number: INM000012449 CIN: U65999MH2019PTC330850</p>	 <p>BIGSHARE SERVICES PRIVATE LIMITED S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400093, Maharashtra, India Telephone: +91 22- 6263 8200 Email: ipo@bigshareonline.com Contact Person: Vinayak Morbale Website: www.bigshareonline.com SEBI Registration Number: INR000001385 CIN: U99999MH1994PTC0765346</p>	<p>Neha Jain Manglam Infra & Engineering Limited H.NO.46, Nikhil Nestles Jatkhedi Hoshangabad Road, University (Bhopal) Huzur, Bhopal - 462026, Madhya Pradesh, India Tel No.: +0755- 2569877/4289475 Website: www.manglaminfra.com Email id: cs@manglaminfra.com</p> <p>Investors can contact the Company Secretary and Compliance Officer, BRLM or the Registrar to the Issue in case of any pre- issue or post issue related problems, such as non-receipt of letters of Allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode.</p>

AVAILABILITY OF RHP: Investors should note that investment in Equity Shares involves a high degree of risk and investors are advised to refer to the Red Herring Prospectus and the Risk Factor contained therein, before applying in the Issue. Full copy of the Red Herring Prospectus shall be available at the website of Stock Exchange www.nseindia.com, the website of Book Running Lead Managers www.unistonecapital.com and from the Registered Office of the Company.

AVAILABILITY OF BID-CUM-APPLICATION FORMS: Bid-Cum-Application forms can be obtained from the Registered Office of the Company: **Manglam Infra & Engineering Limited** (Telephone: +0755 4289475) **BRLM: Unistone Capital Private Limited** (Telephone: 022-4604 6494) **Syndicate Member: Giriraj Stock Broking Private Limited** (Telephone: 033-40054519/ 9547473969), Registered Brokers, RTA and CDPs participating in the Issue. Bid-cum-application Forms will also be available on the websites of, NSE (www.nseindia.com) and the designated branches of SCSBs, the list of which is available at websites of the Stock Exchange and SEBI.

SYNDICATE MEMBER: Giriraj Stock Broking Private Limited

BANKERS TO THE ISSUE/ SPONSOR BANK / ESCROW COLLECTION BANK / PUBLIC ISSUE BANK / REFUND BANK: HDFC Bank Limited

UPI: UPI Bidders can also Bid through UPI Mechanism

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

For MANGLAM INFRA & ENGINEERING LIMITED

On Behalf of the Board of Directors

Sd/-

Ajay Verma

Managing Director

Place: Bhopal

Dated: July 17, 2024

MANGLAM INFRA & ENGINEERING LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the RHP with Registrar of Companies, Gwalior, Madhya Pradesh on July 17, 2024. The RHP shall be available on the website of the BRLM to the issue at www.unistonecapital.com and websites of NSE i.e. www.nseindia.com. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, see section titled "Risk Factors" beginning on page 31 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision.

The Equity Shares offered in the issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and any applicable U.S. state securities laws. There will be no public offering in the United States and the securities being offered in this announcement are not being offered or sold in the United States.

SONATA SOFTWARE LIMITED
CIN : L72200MH1994PLC082110
Registered Office: 208, T V Industrial Estate,
2nd Floor, S K Ahire Marg, Worli, Mumbai - 400 030.
Corporate Office: Sonata Towers, Global Village
(Sattva Global City), RVCE Post, Kengeri Hobli,
Mysore Road, Bengaluru - 560059, India
Tel: +91 80 6778 1000 E-mail: info@sonata-software.com
Website: www.sonata-software.com

NOTICE OF THE 29TH ANNUAL GENERAL MEETING ("AGM") AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Twenty-Ninth Annual General Meeting of Sonata Software Limited (the "Company") will be held on Tuesday, 6th August, 2024 at 2:30 p.m. (IST) through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM"), in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), other applicable Laws, Rules made thereunder and pursuant to the General Circular No. 09/2023 dated September 25, 2023, issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars"). As per the Circulars, Companies are allowed to hold AGM through VC/OAVM without the physical presence of Members at a common venue.

In compliance with the Circulars, the Company has sent the Notice of the AGM along with Annual Report for FY 2023-24 to all Members in electronic mode whose email IDs are registered with the Depository Participant/Registrar and Share Transfer Agent viz. Kfin Technologies Limited ("RTA"). The despatch of the Notice through emails has been completed on July 13, 2024.

The Notice of the AGM and the Annual Report for FY 2023-24 are also available on the Company's website at www.sonata-software.com/about-us/investor-relations and websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL www.evoting.nsdl.com.

Members who are holding shares in demat mode and have not updated their KYC details are requested to register the email and other KYC details with their Depositories through their Depository Participants. Members who are holding shares in physical mode and have not updated their KYC details are requested to submit form ISR-1 (available for download at <https://www.sonata-software.com/about-us/investor-relations>) to update their email, bank account details and other KYC details with Company's RTA. You are requested to email the duly filled in form to inward.ris@kfinitech.com for receiving AGM Notice, e-voting instructions and seamless credit of dividend to their respective bank accounts.

The record date/book closure for the purpose of determining entitlement of members for the Final Dividend of FY 2023-24 is Friday, July 26, 2024. The Register of Members of the Company will be closed from Saturday, July 27, 2024, to Monday, August 05, 2024 (both days inclusive). The Final Dividend, once approved by the Members in the ensuing AGM will be paid within the prescribed timelines.

The Company is providing the facility to its Members to exercise their right to vote on the businesses as set forth in the Notice of the 29th AGM by electronic means through both remote e-voting and e-voting at the AGM. All Members are informed that:

- Members may attend the 29th AGM through VC/OAVM at www.evoting.nsdl.com by using their remote e-voting credentials.
- Members participating through VC/ OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- The instructions for participating through VC/OAVM and the process of e-voting, including the manner in which Members holding shares in physical form or who have not registered their email address can cast their vote through e-voting, are provided as part of the Notice.
- Members whose names appear in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date of Friday, July 26, 2024, shall only be entitled to avail the remote e-voting facility or vote as the case may be at the AGM.
- Remote e-voting shall commence at 9:00 a.m. (IST) on Friday, August 02, 2024, and ends on 5:00 p.m. (IST) on Monday, August 05, 2024. Remote e-voting shall not be allowed beyond 5:00 p.m. on August 05, 2024, and once vote on a resolution has been cast by a Member, the Member will not be allowed to change it subsequently.
- In case a person has become a Member of the Company after dispatch of Notice but on or before the cut-off date for remote e-voting or has registered the email address after dispatch of the Notice, such Member may obtain user ID and password in the manner as provided under the procedure and instructions for e-voting in the Notice.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM may attend the AGM through VC/OAVM but are not entitled to cast their vote again. Members who have not cast their vote through remote e-voting and are present in the AGM through VC/OAVM shall be eligible to vote through e-voting at the AGM.
- In case of queries, Members may refer Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 or send a request to Mr. Falguni Chakraborty at evoting@nsdl.com or write to the Company Secretary at investor@sonata-software.com.

For Sonata Software Limited
Mangal Kulkarni
Company Secretary,
Compliance Officer and Head Legal

Date : July 17, 2024

Place : Bengaluru

NORTH EASTERN RAILWAY E-TENDER

Dy. Chief Electrical Engineer/ Colony, N. E. Railway, Gorakhpur for & behalf of President of India invites "OPEN" E-Tender through online (e-tendering) for the following work:
Tender Notice No & Description of Work : 07-2024-Colony, Name of work:- Electrical work in connection with "Proposed work S&T store at Kawabagh, Gorakhpur". Approx Value ₹. 8.61.153.00, E.M.D. Money ₹: 17,200.00, Cost of Tender Form - Zero, Completion time/ period from the date of issue of acceptance letter -06 Months.
● E-tender online will be submitted upto 15:00 Hrs on dated 05.08.2024.
● Manual offer are not allowed against these tenders and any such manual offer received shall be ignore. For full details and submission of bid please see the Indian Railway IREPS official website www.ireps.gov.in
Dy. Chief Electrical Engineer/Colony, Gorakhpur CP/REL - 80
"Never travel on roof and foot boards."

TENDER NOTICE

Sealed Item Rate tenders are invited for Civil & Structural Repairs, Waterproofing, Plumbing, Painting & Miscellaneous Work of

AMBIKA PARK NO. 2 CHSL

Janta Nagar Road, J. H. Poddar High School Marg, Bhayander (West), Thane - 401101.

Tender forms are available from **VERSATILE CONSULTING ENGINEERS**

230/250, Arun House, Ground floor, RSC - 46, Gorai-2, Borivali (West), Mumbai - 400 091.

Tel: 9920115458 / 9029869000
From: 18.07.2024 to 27.07.2024
Time: 11.00 a.m to 5.00 p.m
Cost of tender document Rs. 3,000/- payable by Cheque in favour of society (Non Refundable)

SIEMENS

CAUTION NOTICE

The following Share Certificates of the Company have been reported as lost/misplaced and the Members have requested the Company for issuance of duplicate Share Certificates.

The notice is hereby given that the Company will proceed to issue duplicate Share Certificates and / or issue Letter of confirmations unless valid objection is received by the Company within 15 days from the date of publication of this Notice and no claims will be entertained by the Company with respect to the Share Certificates mentioned below subsequent to the issue of duplicate share certificates and / or issue of Letter of confirmations in lieu thereof:

Sr. No.	Folio No.	Name of the Member(s)	Share Cert. No.	Dist. Nos.	No. of Shares
1.	SI0003696	Dhanpal Futarmal Ranawat	423021	1532146 – 1532150	5
2.	SI0000778	Immanuel John Wilson Susan Wilson	8452459	169748281 – 169748285	5
			8453433	170077517 – 170077766	250
3.	SI0003534	Shernaz Nariosang Antia Nariosang Hormasji Antia	430265	4354871 – 4355085	215
			8458109	171908499 – 171908713	215
4.	SIM6000209	Madhur Bhalla Parmodh Chander Bhalla	426783	3049196 – 3049250	55
			8455385	170905068 – 170905122	55

Date : 17th July 2024

For Siemens Limited

Siemens Limited

CIN: L28920MH1957PLC010839

Regd. Office: Birla Aurora, Level 21, Plot No. 1080, Dr. Annie Besant Road, Worli, Mumbai - 400 030

Tel.: +91 22 6251 7000

Website: www.siemens.co.in

Email / Contact: Corporate-Secretariat.in@siemens.com / www.siemens.co.in/contact

Ketan Thaker

Company Secretary

ALOK INDUSTRIES LIMITED
CIN: L17110DN1986PLC000334
Regd Office: 17/5/1, 521/1 Village Rakholi / Sayli, Silvassa - 396230
Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu.
Tel No.: 0260-6637001; Email Id.: investor.relations@alokind.com; Website: www.alokind.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter Ended June 30, 2024

(₹. in Crore, except per share data)

Sr. No.	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023
1	Revenue from Operations	1,006.30	1,414.91
2	Net Profit / (Loss) for the period before Tax*	(206.87)	(226.14)
3	Net Profit / (Loss) for the period after tax	(206.87)	(226.14)
4	Total Comprehensive Income for the period	(208.62)	(224.13)
5	Paid up Equity Share Capital, Equity Shares of ₹. 1/- each	496.53	496.53
6	Other Equity excluding revaluation reserve	(20,481.00)	(19,621.09)
7	Earnings per equity share (EPS) (Face value of ₹.1/- each) (Not annualised): Basic (in ₹.) Diluted (in ₹.)	(0.42) (0.42)	(0.46) (0.46)

* Includes Non-Controlling Interest

Notes:

- The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results and its release at the respective meetings held on July 16, 2024. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
- Additional information on Unaudited Standalone Financial Results is as follows:

(₹. in Crore)

Sr. No.	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023
i	Revenue from Operations	968.67	1,365.49
ii	Net Profit / (Loss) for the period before Tax	(197.51)	(220.80)
iii	Net Profit / (Loss) for the period after tax	(197.51)	(220.80)
iv	Total Comprehensive Income for the period	(197.62)	(220.15)

3) The above is an extract of the detailed format of the Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended on June 30, 2024 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended on June 30, 2024 are available on the Stock Exchanges' websites (www.bseindia.com / www.nseindia.com) and the Company's website www.alokind.com.

For Alok Industries Limited

Sd/-

A. Siddharth

Place : Navi Mumbai

Date : July 16, 2024

केनरा बैंक Canara Bank

सिंडिकेट Syndicate

REGIONAL OFFICE NASHIK
4 th floor, Roongta Supremus, Tidke Colony, Chandak Circle, Nashik, 422002

SALE NOTICE

E-AUCTION DATE : 28/08/2024

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISO TO RULE 8 (6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Notice is hereby given to the Public in General and in Particular to the Borrower(s) And Guarantor(s) That The Below Described Immovable Property Mortgaged/charged To The Secured Creditor, The Symbolic / Physical Possession Of Which Has Been Taken By The Authorised Officer Of Canara Bank., Will Be Sold On "as Is Where Is", "as Is What Is" And " Whatever There Is" On 28/08/2024 For Recovery of below Mentioned dues of the of Canara Bank from Respective Borrower / Guarantor mentioned below.

Sr. No.	Name and Address of Borrowers / Guarantors	Description of Immovable Properties	Possession Symbolic/Physical	Reserve Price (Rs.)	EMD Rs.	Amount O/s. Liability (Rs.)	Bid Submission Date	Encumbrances	Authorized Officer Contact
1.	Borrower: M/s. Saptashrungi Steel Corporation Proprietor Shivnath Karbhari Kandekar Address: S. No. 1040, Niphad Yeola Road, Tal- Niphad, Nashik- 422303 Guarantor: Dhananjay Ramdas Dhondage Address: At Post Matoni Tal and Dist Nashik- 422201	1. Flat No. 7, Second Floor, Kulashree Residency Apartment, Plot No. 36, Gat No. 486/36, Near Konark Nagar New Water Tank, Konark Nagar No. 1, Mouje Adgaon, Tal & Dist Nashik in the name of Mr. Shivnath Karbhari Kandekar; build up area about 76.57 sq. mtr. Boundaries: North-Marginal Space; South- Staircase; East- Flat No. 8; West- Marginal Space	PHYSICAL POSSESSION	Rs. 25,21,000/-	Rs. 2,52,150/-	Rs. 5,96,65,408.75/- + Interest applicable & other Charges	On or Before Dt 27-08-2024 at 04:00 pm	NOT KNOWN	Nasik Satpur Industrial Estate, Branch, +91 9634956341
		2. Flat No. 8, Second Floor "Kulashree Residency Apartment" Constructed on Plot No. 36 Gat No. 486/36, Adgaon Shivar Behind Hotel Jatra Opp. Mumbai Agra Road Nashik in the name of Mr. Shivnath Karbhari Kandekar Boundaries: East- Marginal Space ; West- Flat No. 7 North- Flat no. 7 & Marginal Space ; South- Staircase	PHYSICAL POSSESSION	Rs. 12,97,500/-	Rs. 1,29,750/-				
2.	Borrower: M/S Sheetal Engineering Works Proprietor Mr. Laljeet Palakdhari Yadav Address: Shop No 349, Plot No 02 Gangamal Industrial Complex, Opposite Siemens Company Ambad Nashik - 422010.	All that part and parcel of Industrial Gala/Shop No. 349, area admeasuring 43.47 Sq. Mtrs (Built-up) on Second Floor 'C' Wing in building known as "Gangamal Industries & Construction Ltd., situated at village Ambad, Ambad MIDC Industrial Area, Nashik, Tal & Dist. Nashik. Boundaries: North-Gala No. 350; South- Gala No. 348; East- Fire Balcony; West-Passage	PHYSICAL POSSESSION	Rs. 31,30,000/-	Rs. 3,13,000/-	Rs. 41,02,177.89/- + Interest applicable & other Charges	On or Before Dt 27-08-2024 at 04:00 pm	NOT KNOWN	CIDCO Nashik, Branch, +91 7755928542 +91 9634956341
3.	Borrower: Mr. Rajesh Laxman Pangavhane Co-Borrower: Mrs. Anjali Rajesh Pangavane Address 1 : Flat No. 4, Manjula Apartment, Hirawadi Road, Panchavati Nashik-422003 Address 2 : House No. 32, Saraswati Road, Palkhed Canal, Ugaon, Taluka, Niphad District Nashik- 422304	1. All that part and parcel of Flat No. 04, adm. area 92.66 sq. mtrs., carpet area adm. 74.15 sq. mtrs on second floor in Manjula Apartment constructed on plot no. 9, area adm. 171 sq. mtrs + plot no. 10 area adm. 172.40 sq. mtrs. out of S. No. 185/3/1A situated at Nashik, Tal. & Dist. Nashik-422003 Bounded as under East: Plot No. 8 West: Plot No.11 North: 7.5 mtr road South: S. No. 184	SYMBOLIC POSSESSION	Rs. 40,38,000/-	Rs. 4,03,800/-	Rs. 32,05,755.55/- + Interest applicable & other Charges	On or Before Dt 27-08-2024 at 04:00 pm	NOT KNOWN	Gangapur Road Branch, +91 9404553690
4.	Borrower: Mr. Nitin Jaysingh Dhmal Address 1 : Flat No. 602, Sixth Floor, F Wing, Arihant Shree Building, Gajanan Park, Near Chehedi Naka, Nashik Pune Road Nashik, 422011 Guarantor: Mrs. Saraswati Shreepad Galgale Address: Plot No. 225, Narayane, Near Water Tank, Mahatma nagar, Nashik-422007	1. All that part and parcel of Flat No. 602, (built up area 960 sq. ft.) 5 th Floor, F Wing, Arihant Shree Building, Gajanan Park, Survey No. 258/2/2, 258/2/3, 258/2/2/2, 258/2/3/3, near Chedi Naka, Nashik Pune Road, Nashik- 422011 in the ownership of Mr. Nitin Jaysingh Dhmal Bounded as under East: Flat No. 603 Amit Building West: Flat No. 603 Arihant Building North: Flat No. 601 Arihant Building South: Marginal Space	SYMBOLIC POSSESSION	Rs. 34,56,000/-	Rs. 3,45,600/-	Rs. 11,40,610.80/- + Interest applicable & other Charges	On or Before Dt 27-08-2024 at 04:00 pm	NOT KNOWN	Gangapur Road Branch, +91 9404553690

For detailed terms and conditions of the sale please refer the link "E-Auction" provided in Canara Bank's website (www.canarabank.com) or may contact Branch Manager, Canara Bank, during office hours on any working day. Portal of E-Auction: <https://c1india.com>

Date : 16/07/2024

Place : Nashik

Authorised Officer
Canara Bank

